

# ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

મંડળની જાહેરાત ક્રમાંક: ૬૬/૨૦૧૬૧૭ થી ૭૦/૨૦૧૬૧૭ અને  
જા.ક. ૭૧/૨૦૧૬૧૭ થી ૮૧/૨૦૧૬૧૭ અંગેની સુધારા જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટે (૧) તા. ૧૮/૦૪/૨૦૧૫ ના રોજ જાહેરાત ક્રમાંક: ૬૬/૨૦૧૬૧૭ થી ૭૦/૨૦૧૬૧૭ અને (૨) તા. ૨૮/૦૪/૨૦૧૬ ના રોજ જાહેરાત ક્રમાંક: ૭૧/૨૦૧૬૧૭ થી ૮૧/૨૦૧૬૧૭ પ્રસિધ્ધ કરી ઓન-લાઇન અરજીપત્રકો મેળવવામાં આવેલ છે. આ તમામ સંવર્ગોની વિગતવાર જાહેરાતોમાં મુદ્દા નં. ૯ માં પરીક્ષા પદ્ધતિના શિર્ષક હેઠળ પેટા મુદ્દા (૧) માં ઉમેદવારો માટેની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ, ગુણભાર અને સમયની નીચે મુજબની વિગતો દર્શાવેલ છે.

## (૧) સ્પર્ધાત્મક લેખિત કસોટી (પ્રથમ તબક્કાની પરીક્ષા)

(અ) જા.ક. ૬૬/૨૦૧૬૧૭ માટેની સ્પર્ધાત્મક લેખિત કસોટીનો અભ્યાસક્રમ- ગુણભાર અને સમય નીચે મુજબનો રહેશે.

ક્રમ	વિષય	ગુણ	સમયગાળો
૧	સામાન્ય જ્ઞાન- ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ, ભારતનું બંધારણ, રમતગમત, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો, કોમ્પ્યુટરને લગતું સામાન્ય જ્ઞાન, ટેસ્ટ ઓફ રીઝનીંગ, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિગેરે	૩૦	૨ કલાક
૨	ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ	૨૫	
૩	અંગ્રેજી વ્યાકરણ	૨૦	
૪	ગાણિતિક કસોટીઓ, તાર્કિક કસોટીઓ	૧૫	
૫	જગ્યાની તાંત્રિક શૈક્ષણિક લાયકાતને (લઘુત્તમ) સંબંધિત વિષયનું પેપર	૬૦	
	કુલ ગુણ	૧૫૦	

(બ) જા.ક. ૬૭/૨૦૧૬૧૭ થી ૭૦/૨૦૧૬૧૭ અને જા.ક. ૭૧/૨૦૧૬૧૭ થી ૮૧/૨૦૧૬૧૭ માટેની સ્પર્ધાત્મક લેખિત કસોટીનો અભ્યાસક્રમ- ગુણભાર અને સમય નીચે મુજબનો રહેશે.

ક્રમ	વિષય	ગુણ	સમયગાળો
૧	સામાન્ય જ્ઞાન- ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ, ભારતનું બંધારણ, રમતગમત, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો, કોમ્પ્યુટરને લગતું સામાન્ય જ્ઞાન, ટેસ્ટ ઓફ રીઝનીંગ, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિગેરે	૩૦	૧૫૦ મિનિટ
૨	ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ	૩૦	
૩	અંગ્રેજી વ્યાકરણ	૩૦	
૪	ગાણિતિક કસોટીઓ, તાર્કિક કસોટીઓ	૩૦	
૫	જગ્યાની તાંત્રિક શૈક્ષણિક લાયકાતને (લઘુત્તમ) સંબંધિત વિષયનું પેપર	૮૦	
	કુલ ગુણ	૨૦૦	

ઉકત પરીક્ષા પદ્ધતિમાં સરકારશ્રી દ્વારા સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૭/૦૫/૨૦૧૬ ના પત્રથી આંશિક ફેરફાર કરીને નીચે મુજબનો સુધારો કરવામાં આવેલ છે. તેથી હવે ઉકત તમામ સંવર્ગોની જાહેરાતો માટેનો સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ, ગુણભાર અને સમયગાળામાં આથી નીચે મુજબનો સુધારો બહાર પાડવામાં આવે છે.

### (૧) સ્પર્ધાત્મક લેખિત કસોટી (પ્રથમ તબક્કાની પરીક્ષા)

(અ) જા.ક. ૬૬/૨૦૧૬૧૭ માટેની સ્પર્ધાત્મક લેખિત કસોટીનો અભ્યાસક્રમ- ગુણભાર અને સમય હવે નીચે મુજબનો રહેશે.

ક્રમ	વિષય	ગુણ	સમયગાળો
૧	સામાન્ય જ્ઞાન- ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ, ભારતનું બંધારણ, રમતગમત, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો, કોમ્પ્યુટરને લગતું સામાન્ય જ્ઞાન, ટેસ્ટ ઓફ રીઝનીંગ, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ, ગાણિતિક કસોટીઓ વિગેરે	૨૦	૯૦ મિનિટ
૨	ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ	૧૫	
૩	અંગ્રેજી વ્યાકરણ	૦૫	
૪	જગ્યાની તાંત્રિક શૈક્ષણિક લાયકાતને (લઘુત્તમ) સંબંધિત વિષયનું પેપર	૬૦	
	કુલ ગુણ	૧૦૦	

(બ) જા.ક. ૬૭/૨૦૧૬૧૭ થી ૭૦/૨૦૧૬૧૭ અને જા.ક. ૭૧/૨૦૧૬૧૭ થી ૮૧/૨૦૧૬૧૭ માટેની સ્પર્ધાત્મક લેખિત કસોટીનો અભ્યાસક્રમ- ગુણભાર અને સમય હવે નીચે મુજબનો રહેશે.

ક્રમ	વિષય	ગુણ	સમયગાળો
૧	સામાન્ય જ્ઞાન- ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ, ભારતનું બંધારણ, રમતગમત, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો, કોમ્પ્યુટરને લગતું સામાન્ય જ્ઞાન, ટેસ્ટ ઓફ રીઝનીંગ, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ, ગાણિતિક કસોટીઓ વિગેરે	૩૦	૧૨૦ મિનિટ
૨	ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ	૨૦	
૩	અંગ્રેજી વ્યાકરણ	૧૦	
૪	જગ્યાની તાંત્રિક શૈક્ષણિક લાયકાતને (લઘુત્તમ) સંબંધિત વિષયનું પેપર	૯૦	
	કુલ ગુણ	૧૫૦	

ઉપર વર્ણવ્યા મુજબનો સુધારેલ અભ્યાસક્રમ, ગુણભાર અને સમય ની સંબંધિત સર્વે ઉમેદવારોએ જરૂરી નોંધ લેવાની રહેશે. અને ઉકત જાહેરાતો અન્વયેની ઉકત ત્રણ મુદ્દાઓ સિવાયની અન્ય તમામ વિગતો અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલ મૂળ જાહેરાતોમાં દર્શાવ્યા પ્રમાણેની યથાવત રહેશે.

સ્થળ:- ગાંધીનગર

તારીખ- ૨૮/૦૯/૨૦૧૬

સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

ગાંધીનગર